

11 મે 2018

સીટી ઓફ બ્રમ્પટન જીએ ઓપન સીટી ચેમ્પિયન એવોર્ડ

બ્રમ્પટન, ઓન્ટારિયો – આજે આજે સીટી ઓફ બ્રમ્પટનના GIS અને ઓપન ડેટાના ટીમલીડ મેટ પિએટ્રિઝિનને ઓપન સીટી ચેમ્પિયન એવોર્ડના વિજેતા જાહેર કરવામાં આવ્યા. ઈન્ટરનેશનલ ઓપન ગવર્નમેન્ટ વીકના ભાગરૂપે પબ્લિક સેક્ટર ડાઈજેસ્ટ દ્વારા આયોજિત ઓપન સીટી ચેમ્પિયન એવોર્ડ, વધુ ખુલ્લા, પારદર્શક અને જવાબદારીપૂર્ણ સ્થાનિક સરકારની પ્રતિબદ્ધતાની કદર કરે છે.

પબ્લિક સેક્ટર ડાઈજેસ્ટ દ્વારા ઓપન સીટી ચેમ્પિયન્સના ત્રણ વર્ગોનું બહુમાન થયું: કમ્યુનિટી લિડર, સીટી કાઉન્સિલ લિડર અને સીટી એડમિનિસ્ટ્રેટિવ લિડર. મેટ સીટી એડમિનિસ્ટ્રેટિવ લિડર વર્ગ હેઠળ વિજેતા બન્યા.

GIS અને ઓપન ડેટાના ટીમલિડ તરીકેના તેઓના હોદ્દામાં, મેટ એક ઈનોવેટિવ અને સમર્પિત ટીમનું ધ્યાન રાખવાની જવાબદારી ધરાવે છે જેમનું બ્રમ્પટનના ઓપન ડેટા પ્લેટફોર્મ જિયોહબ (GeoHub) પર થયેલ કાર્ય લોકો માટે મિલકતના નક્શા, બાઈકના નક્શા અને ઝોનિંગ ઉપનિયમો જેવી જાહેર માહિતીનું અભિગમન સરળ બનાવે છે. તેમાં પહેલ દ્વારા ચાલતા ટૂલ્સ હોય છે જે પારદર્શકતા વધારવામાં મદદરૂપ થાય છે અને નવીનીકરણને પ્રોત્સાહિત કરે છે. જિયોહબ (GeoHub)નો ઉપયોગ ડેટાસેટ્સ સંયોજિત કરવા માટે અને નક્શા તથા ચાર્ટ્સ મારફત વિશ્લેષણ કરવા માટે થાય છે અથવા કોઈ વાત કહેવા માટે ડેટા ડાઉનલોડ કરવા માટે થાય છે.

GIS અને ઓપન ડેટા ટીમ (Open Data team)ના સદસ્યો દૂતોનું કાર્ય કરે છે અને સ્થાનિક હાઈ સ્કૂલના વર્ગોની મુલાકાત તે માટે કરે છે કે તેઓ જાણાવી શકે કે જિયોહબ (GeoHub) પર મળતા સીટીના અધિકૃત ડેટા અને વિશ્લેષણ ટૂલ્સનો સદુપયોગ કેવી રીતે કરી શકાય.

આ કોઈ પ્રથમ વખત નથી કે સીટી અને તેના કર્મચારીગણ ઓપન ડેટા પર ચાલુ રહેતા પ્રયાસોની કદર થઈ હોય. ઓક્ટોબર, 2017માં સીટીએ જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ (GIS)ના ક્ષેત્રમાં એસી કનેડા (Esri Canada)નો એવોર્ડ ફોર ઈનોવેશન GIS ટેકનોલોજીનો ઉપયોગ ઓપન ગવર્નમેન્ટ પહેલને ટેકો આપવા માટે કરવા પ્રાપ્ત કર્યો હતો. જૂન 2017માં સીટીને એડમન્ટન ખાતે થયેલ કૅનેડિયન ઓપન ડેટા સમિટમાં ઓપન ડેટા રાઈઝિંગ સ્ટાર (Open Data Rising Star) એવોર્ડ ફોર જિયોહબ (GeoHub) પ્રાપ્ત થયો હતો.

બ્રમ્પટન જિયોહબ(Brampton GeoHub)નું સંશોધન કરવા માટે અહીં મુલાકાત લો <http://geohub.brampton.ca>

ક્વોટ:

"સીટી ઓફ બ્રમ્પટન ભવિષ્ય માટે સજ્જ શહેર બનાવવા માટે કાર્ય કરે છે અને સરકારી સેવાઓમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિબદ્ધ છે. જિયોહબ (GeoHub) મારફત કર્મચારીગણ પારદર્શક સેવા પૂરી પાડવાની સાથે બ્રમ્પટનવાસીઓ સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તેમાં પણ નાવિન્યને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. મેટ અને GIS તથા ઓપન ડેટા ટીમ જે કાર્ય કરી રહ્યા છે તેનો મને ગર્વ છે અને કર્મચારીગણના પ્રયાસો કેવી રીતે જાહેર જનતા તેમના સમુદાયને સમજી શકે અને વ્યવહારો કરવાની શક્યતામાં વધારો કરશે તે જોવા આશાસ્પદ છે."

- જોએફ પિટારી, કમિશ્નર ફોર કોર્પોરેટ સર્વિસિસ

"અમે જ્યારે બ્રમ્પટનના જિયોહબ (GeoHub) વિશેના વધુને વધુ ડેટા અને ટૂલ્સ ઉપલબ્ધ કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે સીટીને સમુદાય સાથે કામ કરવાની અને વ્યવહાર કરવાની અનન્ય તક સાંપડી છે. જનતા સાથેના આવા ચાલુ રહેતા વ્યવહાર અને વિચારોની આપણે જ ભવિષ્ય માટે સજ્જ, સ્માર્ટ સીટી તરીકેની બ્રમ્પટનની સફળતાની ચાવી છે એવું યોક્કસ જ કહી શકાય."

- મેટ પિએટ્રિઝિન, ટીમ લિડ, GIS અને ઓપન ડેટા

-30

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

નેટલી સ્ટોગ્ડિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા (Media Coordinator)

સીટી ઓફ બ્રમ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca